




“સહકાર થી સમૃદ્ધિ”

પંચમહાલ
બેંકની
ડિજિટલ
સેવાઓ...



શ્રી જેઠાભાઈ આહિર

ચેરમેનશ્રી - નાફેડ, ન્યુ દિલ્હી

ધારાસભ્યશ્રી - ૧૨૪ શહેરા વિધાનસભા

ચેરમેનશ્રી - પંચમહાલ જિલ્લા સહકારી બેંક લી., ગોધરા

ચેરમેનશ્રી - પંચમહાલ ડેરી, ગોધરા

પ્રવિણસિંહ યુ. બારીઆ
વાઈસ ચેરમેન



રસેષ પી. શાહ
ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર

ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંક લિ., ગોધરા

THE PANCHMAHAL DISTRICT CO-OPERATIVE BANK LTD.

હેડ ઓફીસ :- ગાંધી ચોક, ગોધરા - ૩૮૯ ૦૦૧.

ફોન : ૨૫૦૮૫૩, ૨૪૦૯૫૨, ૨૪૯૨૪૭

ઈમેલ : establishment@pdc.bank.in

વેબસાઈટ : www.pdc.bank.in

ટોલ ફ્રી નંબર : ૯૦૯૦૫૦૫૦૫



પંચમહાલ બેંકની ડિજિટલ સેવાઓ...



રૂપે ડેબિટ કાર્ડ (ATM CARD)



એસ.એમ.એસ. (SMS)



મોબાઇલ બેંકિંગ



ઇન્ટરનેટ બેંકિંગ



RTGS / NEFT / IMPS



એટીએમ/માઇક્રો એટીએમ



વોટ્સએપ બેંકિંગ (Whatsapp Banking)



ગુપીઆઈ (G PAY-PAYTM-PHONE PAY)



મીસ્ડકોલ એલર્ટસ (Missed Call Alert)



પીઓએસ મશીન (POS Machine)



ડેબિટ કાર્ડ ઇ-મેન્ડેટ (Debit Card E-mandate)



બીબીપીએસ (BBPS)



QR કોડ



Aaps (Aadhaar Enabled Payment System)

ડીજિટલ સેવાઓ...



રૂપે ડેબિટ કાર્ડ (ATM CARD)

બેંકના તમામ ગ્રાહકોને બેંક મારફતે ડેબિટ કાર્ડ (ATM) આપવામાં આવે છે, જેના મારફતે ગ્રાહક આ બેંકના કે અન્ય કોઈપણ બેંકના ATM માંથી સમગ્ર ભારતમાંથી ગમે ત્યાંથી નાણાં ઉપાડી શકાય છે. તેમજ તમામ ઇ-કોમર્સ એપ્લિકેશન પરથી આ બેંકનાં ATM કાર્ડ દ્વારા ખરીદી કરી શકે છે, તેમજ કોઈપણ બિલનું ચુકવણું કરી શકાય છે.



એસ.એમ.એસ. (SMS)

બેંકના તમામ ગ્રાહકોને તેમના ખાતામાં કરવામાં આવતાં તમામ નાણાકીય વ્યવહારોની લેવડ-દેવડની માહિતી તેમના બેંક ખાતામાં નોંધાયેલ મોબાઇલ નંબર ઉપર મેસેજ (SMS) દ્વારા જાણ કરવાની સુવિધા આપવામાં આવે છે.



મોબાઇલ બેંકિંગ

બેંકની મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. જેની મદદથી આપના ખાતાનું બેલેન્સ જાણી, IMPS-NEFT-RTGS સુવિધા મારફતે આપના ખાતાના બેલેન્સમાંથી નાણાં ટ્રાન્સફર કરી લેવડ-દેવડ પણ કરી શકો છો.



INTERNET BANKING

ઇન્ટરનેટ બેંકિંગ

ઇન્ટરનેટ બેંકિંગની મદદથી આપના ખાતાનું બેલેન્સ જાણી, IMPS-NEFT-RTGS સુવિધા મારફતે આપના ખાતાના બેલેન્સમાંથી નાણાં ટ્રાન્સફર કરી લેવડ-દેવડ પણ કરી શકો છો.



RTGS / NEFT / IMPS

બેંકની કોઈપણ શાખામાંથી IMPS-NEFT-RTGS સુવિધા મારફતે આપણી બેંકના ખાતેદારો પોતાના ખાતાના જમા બેલેન્સમાંથી ઇલેક્ટ્રોનિક નાણાં ટ્રાન્સફર સમગ્ર ભારતમાં ગમે તે બેંકમાં ગમે તેના ખાતામાં કરી શકાય છે.



એટીએમ/માઇક્રો એટીએમ

આ સુવિધાની મદદથી આપ આપણી નજીકના બેંક મિત્ર પાસેના MICRO ATM તેમજ ATM મશીનની મદદથી ATM ડેબિટ કાર્ડ દ્વારા બેલેન્સ ઇન્કવાયરી, પૈસા ઉપાડ, જમા, ટ્રાન્સફર તેમજ ગ્રીન પીન દ્વારા ATM ડેબિટ કાર્ડનો પીન નવો બનાવી શકાય છે અને બદલી પણ શકાય છે.



વોટ્સએપ બેંકિંગ (Whatsapp Banking)

સેવાનો લાભ લેવા માટે +૯૧૬૩૫૭૪૨૬૭૧૯ આ નંબર સેવ કરી વોટ્સએપ પર HA મેસેજ કરવો જેનાથી બેલેન્સ ઇન્કવાયરી, મીની સ્ટેટમેન્ટ, સ્ટેટમેન્ટ જેવી અનેક સુવિધાનો લાભ લઈ શકો છો.

ડીજિટલ સેવાઓ...



યુપીઆઈ (G PAY-PAYTM-PHONE PAY)

આ સુવિધાની મદદથી આપ આપણા મોબાઈલમાં જાણીતી BHIM-GPAY-PAYTM-PHONE PAY જેવી એપ્લિકેશનની મદદથી આપ સહેલાયથી UPI એફસ તેમજ મોબાઈલ નંબર મારફતે નાણાં પોતાના ખાતામાંથી ચુકવણી અને પોતાના ખાતામાં નાણાં જમા સ્વીકારી શકાય તેમજ બીજી સુવિધા જેવી કે લાઈટબીલ, મોબાઈલ રિચાર્જ, ફાસ્ટટેગ રીચાર્જ, ગેસ બિલ જેવા વગેરે બિલ ઓનલાઈન ભરી શકો છો.



મીસ્ડકોલ એલર્ટસ (Missed Call Alert)

સેવાનો લાભ લેવા માટે +૯૧૭૦૬૫૦૧૬૯૦૦ આ નંબર પર મિસ કોલ કરવાથી આપ આપણા ખાતાનું બેલેન્સ જાણી શકો છો.



પીઓએસ મશીન (POS Machine)

આપની શાખા કાર્યવિસ્તારના વેપારીઓ, પેટ્રોલ પંપ કે અન્ય કોઈપણ દુકાનદાર આ POS મશીન લઈ શકે છે. POS મશીન દ્વારા તમામ નાણાકીય વ્યવહાર થઈ શકે છે. જેનાથી સમયનો બચાવ તેમજ જે તે સ્થળેથી જ લાભ લઈ શકાય છે.



ડેબિટ કાર્ડ ઇ-મેન્ડેટ (Debit Card E-mandate)

આ સેવા થકી વ્યાપારીઓને ગ્રાહકના બેન્ક ખાતામાંથી તેમના ડેબિટ કાર્ડ દ્વારા નિશ્ચિત અથવા પરીવર્તન રકમ આપમેળે ડેબિટ કરવાની મંજૂરી આપે છે. આનો ઉપયોગ સામાન્ય રીતે સબસ્ક્રીપ્શન લોન હમ્પાઓ અથવા ઉપયોગિતા બીલ જેવી પુનરાવર્તિત ચુકવણીઓ માટે થાય છે. તે ચુકવણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરે છે, જે ગ્રાહકો અને સેવા પ્રદાતાઓ બંને માટે અનુકૂળ અને લાભદાયી છે.



બીબીપીએસ (BBPS)

આ સેવા હાલમાં ઓનલાઈન તથા મોબાઈલ પ્લેટફોર્મ ઉપર OSTA APP મારફતે બેંક ચાલુ કરેલ છે. સદર સેવા મારફતે બેંકના ગ્રાહકોને ઓનલાઈન તેમજ શાખાઓ મારફત ઓનલાઈન બીલ પેમેન્ટ જેવા કે, ઇલેક્ટ્રીસિટી, પાઈપ ગેસ, પાણી, બ્રોડ બેન્ડ, એલપીજી સીલીન્ડર, ફાસ્ટટેગ, કેબલ ટી.વી., લેન્ડ લાઈન, પોસ્ટ પેઈડ, હેલ્થ ઇન્સ્યોરન્સ, લોન પેમેન્ટ, લાઈફ ઇન્સ્યોરન્સ ઓન લાઈન બીલ પેમેન્ટ ઉપરાંત ઓનલાઈન રીચાર્જ પણ કરી શકશે.



QR કોડ

બેંકની QR કોડ સેવાઓ ડિજિટલ પેમેન્ટને સરળ અને સુરક્ષિત બનાવે છે. QR કોડ દ્વારા બેન્કના ગ્રાહકો કેશલેસ ટ્રાન્ઝેક્શન કરી શકે છે. દુકાનદારો, ફેરિયાઓ તેમજ દૂધ વિતરણ કેન્દ્રો બેંક પાસેથી પોતાનો QR કોડ મેળવી સીધા બેંક ખાતામાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી શકે.



Aeps (Aadhaar Enabled Payment System)

બેન્કની AePS સેવા સુરક્ષિત બેન્કિંગ સેવા છે. તેના દ્વારા ગ્રાહકો માત્ર પોતાના ૧૨-અંકના આધાર નંબર અને ફિંગરપ્રિન્ટ (બાયોમેટ્રિક) દ્વારા કોઈપણ બેન્ક ખાતામાંથી નાણાકીય વ્યવહારો તેમજ સ્ટેટમેન્ટ મેળવી શકે છે. AePS નો ઉપયોગ કરવા માટે, તમારું બેન્ક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે.